



MIGRATION CERTIFICATE FORM

(To be filled by the student) (વિદ્યાર્થી જાતે ભરવું)

1. Name in full _____
(પૂરું નામ) અટક નામ પિતા/પતિનું નામ

2. Postal Address _____
(સરનામું) _____

Mobile No. _____
(મોબાઇલ નંબર)

3. College/Ins. now joined _____
(કોલજ/સંસ્થામાં જોડાનાર હો તેનું નામ)

4. University to which migrated _____
(જે યુનિવર્સિટીમાં જોડાયા હો તેનું નામ)

5. College/Institution last attended & date of leaving _____
(છેલ્લે જે કોલજ/સંસ્થામાં અભ્યાસ કર્યો હોય તેનું નામ અને છોડ્યાની તારીખ)

6. Birth Date _____
(જન્મ તારીખ)

7. Information regarding Examination passed/failed of this University :

Name of exam (પરીક્ષાનું નામ)	Seat no (બેઠક નંબર)	Year (વર્ષ)	Centre (કેન્દ્ર)	Class (વર્ગ)	Passed/Failed (પાસ/નાપાસ)	If Result is withheld state reasons પરિણામ અટકાવ્યું હોય તો તેના કારણો

8. Date and no. of transference Certificate

9. Issued by College/Institution last attended: _____
(છેલ્લે જે કોલજ/સંસ્થામાં અભ્યાસ કર્યો હોય તે સંસ્થા છોડ્યાના પ્રમાણપત્રનો નંબર અને તારીખ)

10. Furnish other particulars (if necessary) _____
(અન્ય વિગતો જરૂરી હોય આપવી)

Date:(તારીખ) _____ Signature of the applicant (અરજદારની સહી) _____

Received Migration Certificate No.

Date:

with original marksheets.

Date:(તારીખ) _____ Signature of the applicant (અરજદારની સહી) _____

To be filled in by The Principal/Head of Institution/Concerned University

I have the honour to forward the above application for issuing a Migration Certificate. The above applicant has not been rusticated or debarred at any exam by the University. I have no objection to issue Migration Certificate to the applicant by the University.

As per college record his/her date of birth is _____ Applicant has been a bona-fide student of this institution since _____ and left in _____

The Transference Certificate (T.C.) issued to the applicant Mr. _____ and is enclosed herewith.

T.C. No _____ Date _____

Yours faithfully

Date : _____

Place : _____

Signature

Principal/Head/Concerned authority
(Seal of Institution)

Instructions to Candidates for obtaining Migration Certificate

1. The student desiring to obtain a Migration Certificate should apply in the prescribed form of application for Migration Certificate obtainable from the University or the college office on payment of prescribed fee and submit it through the University/School/Dept./College/Institution.
2. While submitting the application to the Office, the student should pay the fees to the college for the Transference Certificate. **Migration Certificate Fees (Rs. 300/-)** should as far as possible be paid after necessary endorsement on the application is obtained from the College and Transference Certificate is issued by the University/School/Dept./College. The Migration Certificate fee Rs. 300/- shall be paid online on University Website. The Migration Certificate form should be accepted within all required documents and fee payment receipt.
3. Each application form for Migration Certificate must be accompanied by a Transference Certificate duly signed by the Director/Head/Principal of the University/School/Dept./College last attended by the student and original statement of marks (and certificate Xerox copy there of) obtained by the applicant at the Examination at which he/she appeared last.
4. A Duplicate Migration Certificate will only be issued on undergoing a fresh procedure as stated above.
5. The student must furnish the bonafide Certificate/Certificates of the affiliated University/School/Dept./College joined here to before.